

શિક્ષણ અને સમાજ
કલ્યાણ કેન્દ્રનું
માસિક મુખ પત્ર



વર્ષ : ૧૨

અંક : ૯

સમસ્યાઓનો હલ

માણસના જીવનમાં કોઈ પ્રશ્નો ના હોય તો જીવવાની મજા ના આવે, એને હલ કરવા માટે મથામણ કરવી પડે. એના કારણે તન અને મનને કામે લગાડવું પડે. માણસનું સાચું ઘડતર પ્રશ્નો દ્વારા થાય છે. દરેકની સ્થિતિ પ્રમાણે એને પ્રશ્નો હોય છે. મોટાને મોટા પ્રશ્નો હોય તો નાના ને નાના. માણસ સમજણો થાય ત્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. સમાજમાં ભાત ભાતને જાત જાતના લોકો વસતા હોય છે. દરેકને કંઈ ને કંઈ ખુટતું હોય છે. એ અભાવને ભરવા માટે માણસ કંઈક ને કંઈક કરતો હોય છે. પ્રશ્નો તો પડકાર છે. એને સામી છાતીએ ઝીલી લેવા એ મદદનગી છે. જે માણસ પ્રશ્નોની સામે શાહમૃગવૃત્તિ દેખાડે છે. એ એના જીવનમાં કશું કરી શકતો નથી. માણસે હંમેશા જે સમસ્યા હોય એની પુર્તિ કરવાની હોય છે. સમસ્યાનો ઉકેલ લાવવો, એનો યોગ્ય જવાબ આપવો અને એનો અધુરો ભાગ હોય તેને પુરો કરવો. અધુરું કશું રખાય નહીં. આપણે કહીએ છીએ કે, ભાઈ દરેકને પોત પોતાની સમસ્યાઓ હોય છે. હાથી ને મણ તો કીડીને કણ જેવી જેની તાકાત એવો

એનો ભાર હિન્દીમાં એક પંકિત છે. હાથી અપને પાંચ ભારી, ચીટી અપને પાંચ ભારી. હાથી જેવી રીતે પોતાના પગ ઉપર પોતાનો ભાર અનુભવ કરે છે એવી રીતે કીડી પોતાના પગ ઉપર. દરેક પોત પોતાની સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે, એમને જો કોઈ સમસ્યા ન હોય તો ચેન ના પડે આપણે ત્યાં કહેવાય છે કે, કાં તો મારી સાથે લડ અથવા લડનાર આપ કંઈક તો કરવું પડે કે નહીં આપણા નખની જેમ ઉંદરના દાંત વધતા રહે છે, જો એ સતત કંઈ ને કંઈ કર્યા ન કરે તો એના જ દાંતથી એનું મોત થાય છે. એટલે સમસ્યાથી માણસની બુધ્ધીને ધાર મળે છે. માણસ સજાગ થાય છે માણસ સમસ્યાના કારણે પ્રવૃત્તિશીલ બનતો હોય છે. કેટલાક લોકો જ્યારે સમસ્યા ઉભી થાય ત્યારે એ તો ભગવાને ધાર્યું હશે તે થશે, એમ માની ને બેસી રહે છે. આપણે જો જમવું હોય તો રાંધવું પડે હાથ-પગ હલાવ્યા વિના કોઈ સમસ્યા ક્યારેય હલ થતી નથી. બીજાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મથતા હોય છે. એમની નિયતી સાફ ન હોય તો ન કલ્પી શકાય એવું નુકશાન કરતા હોય છે.

સંકલન : હેતલ વેકરીયા

તડકો-છાયો એ જીવનનું કર્મ છે

નાગરવેલનુ પાન એક ઔષધ

ભારતના ભવ્ય ભૂતકાળમાં સુખી સમાજ ભોજન પછી પાન આરોગતો, આરોગ્યની જાળવણી અને પાચન માટે પાન ખાવાનો રિવાજ હતો. ઔષધો બનાવવામાં પાનના રસનો સારો એવો ઉપયોગ થયો છે. પાનના રસનો અનુપાન તરીકે ઉપયોગ અનેક રોગોમાં થાય છે. બાળકોની વધારાની દવા મધ અને નાગરવેલ પાનના રસમાં આપવાથી ઝડપી પરિણામ મળે છે. પાન ખાવાથી સુંદર પાચન અને આરોગ્ય મળતા પરંતુ હવે પાનમાં તમાકુ અને કીમામ જેવી ચીજો વપરાવા લાગી ત્યારથી પાન ખાવાનું લાભકર્તાને બદલે હાનીકર્તા સાબીત થયું છે. વધારે પડતો ચુનો અને તમાકુ કે કીમામવાળા પાન વધારે ખાવાથી કેન્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે.

મોટા ભાગના લોકો પાન આરોગી આસ્વાદનો આનંદ માણે છે. આ પાનનું મુળ વતન મલેશિયાને માનવામાં આવે છે અને ધીમે ધીમે એશિયાના બીજા દેશોમાં અને ભારતમાં પ્રવેશ્યું હશે એમ લાગે છે. પાનનો ઉપયોગ આજે મુખવાસ તરીકે છુટથી થાય છે. જ્યારે વૈદ્યો એનો ઉપયોગ ઔષધ તરીકે કરી ખુબ જ યશ મેળવે છે. બાળકોના કફના રોગમાં પાનનો સારો એવો ઉપયોગ થાય છે અને અસરકારક પણ એટલો જ છે. આપણે જે પાનને રોજ આરોગીએ છીએ તે પાનમાં પડેલ ઔષધીય ગુણોથી ઘણાં

અજ્ઞાત છીએ કેટલાંક લોકો તો પાન ખાવા ખાતર ખાય છે એની પાછળની કોઈ ઉંડી સમજ હોતી નથી. આ નાગરવેલના પાનના વેલા થાય છે. એની રીતસરની ખેતી આપણા દેશમાં કરવામાં આવે છે. પાનના અનેક પ્રકાર થાય છે છતાં તેના ગુણદોષમાં કોઈ ખાસ ફેર નથી. સામાન્ય રીતે પાન મુખશુદ્ધિ, રૂચિવૃદ્ધિ અને મુખદુર્ગંધી દુર કરવા માટે વપરાય છે. બુદ્ધિજીવીઓ અને બેઠાડું જીવન જીવનારને પાનને ખોરાકનું સરળતાથી પાચન થાય તે માટે ખાય છે આયુર્વેદે એના ગુણગાન ગાતા લખ્યું છે કે, નાગરવેલના પાન ઉત્તમ દીપન પાચન છે અને એટલે આપણે ત્યાં જમણવાર પછી પાનનું બીડું આપવાનો રીવાજ છે. આ ઉપરાંત પાન કફકર, વાયુ હરનાર, પિત્તપ્રકોપ, વ્રણરોપક, મોની ચીકાશ અને દુર્ગંધ દુર કરનાર અને કામોત્તેજક છે તેનાથી શરીર અને મનની મસ્તીમાં વધારો થાય છે.

સંકલન : હેતલ વેકરીયા

આ માસમાં સંસ્થાના શુભેચ્છકશ્રીઓ

તુષાર ભટ્ટ	૧૦૦	વિનોદ પ્રજાપતી	૮૪૦
પાર્થ બાસુ	૮૪૦	સમાધાન કસર	૮૪૦
સુબ્રમણ્યમ	૮૪૦	રમેશ જોગાણી	૩૮૦૦
હીતેન્દ્ર પંચાલ	૮૪૦	નરેન્દ્ર બલીગા	૮૪૦૦
પ્રવિણ ઉભારે	૮૪૦	આયુશ પુરી	૨૦૦૦
લક્ષ્મણભાઈ ડોબરીયા	૮૪૦		

નિષ્ઠા પૂર્વકનું કામ એ વ્યક્તિના વિકાસનો પાયો છે.

સ્વ સહાય જુથ રચના કાર્ય

એપ્રિલ ૨૦૦૮ થી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં નાબાર્ડ અનુદાનિત ૧૦૦ સ્વ સહાય જુથોના પ્રમોશન અને ક્રેડીટ લીકેજની કામગીરી હરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તા. ૨૪ સપ્ટેમ્બર ૧૦ ના રોજ આ પ્રોજેક્ટની પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન અને મોનીટરીંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં સંસ્થાના કાર્યકર દયાબેન જાદવના જણાવ્યા અનુસાર ૧૦૦ ઉપરાંત જુથોની રચના/પ્રમોશનની કાર્યવાહી થઈ છે પરંતુ અમુક જુથ નિષ્ક્રય પણ બન્યા છે તેને ફરી સક્રીય કરવા જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે આ ૧૦૦ જુથો પૈકી આ માસના અંત સુધીમાં ૮૦ જુથોના બેંકમાં ખાતા ખોલવાની કામગીરી પુર્ણ થશે.



૩૧ જુથોનું ગ્રેડીંગ કાર્ય પુર્ણ થયું છે તેના લોન ફોર્મ તૈયાર કરી આ માસના અંત સુધીમાં બેંકમાં રજુ થશે. આગામી છ માસમાં બાકી રહેતા જુથોના ગ્રેડીંગ તથા લોનની કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત હાલ દરેક જુથમાં ઈન્ફોર્મલ ટ્રેનીંગ થઈ રહી છે. જમાં જુથના સભ્યો દફતરની વ્યવસ્થિત જાણવણી કરે તેમને હિસાબો અને મીટીંગના પ્રોસીડીંગ નિયમાનુસાર રાખે તે માટેના મુદ્દાઓનો સમાવેશ કરેલ છે.

સ્વાવલંબન સફળતાની સીડીનું પહેલું પગથીયું છે.

યુવા શિબિર – અંભેટી

સાંપ્રત સમયમાં આજે ગામડુંએ વિશ્વગ્રામ બની ચુક્યું છે. બદલાયેલા સમયમાં વિકાસની આંધળી દોડમાં ટકાઉપણાનાં સંદર્ભે ઉભા થયેલા પડકારો અને અવરોધોને પહોંચીવળવા ગ્રામસ્વરાજ, સ્વાવલંબન અને ગ્રામ વિકાસની વિભાવના અને અમલીકરણની પદ્ધતિમાં બદલાવએ અનિવાર્ય છે. આ કામને વ્યાપક રીતે પાર પાડવા નવી સમજણ, નવી કુશળતા કે સજજતાવાળા કર્મશીલો અને નિષ્ઠાવાન યુવકો ગ્રામ કક્ષાએ લોકો માટે, લોકો સાથે અને લોકો વચ્ચે રહીને કામ કરે, આજનો યુવાન પોતાનાં ઘર, સમાજ, ગામ તથા તેમના વિસ્તારને કેવી રીતે કામ આવી શકે અથવા કેવી રીતે ગામનો વિકાસ કરી શકે તે માટે ટપ યુવક યુવતિઓ આ શિબિરમાં જોડાયા હતા જેમાં હરિરાજ ધરમપુરની ટીમ તથા હરિરાજમાં ફીલ્ડ વર્ક માટે આવેલા સુપાસી બીએસડબલ્યુના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પ્રાર્થના અને પરિચય બાદ બધા યુવાનોને એક ફોર્મ આપવામાં આવ્યું. જેમાં નામ ગામ પોતાની મર્યાદા, પોતાની આવડત, અપેક્ષા અને લોકો માટે શું કરી શકે તે લખીને તે દરેકએ વારા ફરથી રજુઆતો કરી.

એક અભિનય ગીત "હું અને પોપટલાલ જંગલમાં ગ્યાતાં" રજુકર્તાને જોઈને બધાએ એ

અભિનય કરવાનું હતું જેમા બધા ને ખુબજ મજા આવી.

સ્વૈચ્છીક સંસ્થાઓના કર્મચારીઓને એક બીજાને પ્રશ્ન હોય તો તે પુછવાના તથા કોઈ આવડત હોય તો એક બીજાને પુછવી તથા હલ કરવો તે માટે બધાને એક કલાક ફાળવવામાં આવ્યો. તેમાં બાયફ, પર્યાવરણ શીક્ષણ કેન્દ્ર, હરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વક્તાઓ તથા પ્લેસમેન્ટમાં આવેલા ભાઈઓએ પરીચય કેળવ્યો.

શિબિરના મુખ્ય મુદ્દાઓ :

૧. ગ્રામ શિલ્પી તરીકે કરેલ પ્રવૃત્તિની રજુઆત પર ચર્ચા કરવામાં આવી જેમાં ગ્રામ શિલ્પી એટલે કે સમાજ કાર્યકર તરીકે જે પ્રવૃત્તિ કરી હોય જયારથી નોકરી અથવા સેવા આપતા હોય તેવી પ્રવૃત્તિની રજુઆત કરવાની હતી. યુવા શિબિરમાં ઘણાં બધા લોકો હાજર રહેલા હતા તેમાંથી જે લોકો ગ્રામ શિલ્પ તરીકે જોડાયેલા હતા તેમણે અત્યાર સુધી ગામડામાં જઈને કઈ કામગીરી કરી ગામલોકોને શું મદદરૂપ થયા તે કામગીરી ની ટુંકમાં વર્ણન કર્યું જેમાં ગામડાનો વિકાસ, ગામની સમસ્યા ઉપર ચર્ચા કરી.

૨. હું કોણ છું? એ મુદ્દા પર નીલમભાઈ તથા પર્યાવરણ શીક્ષણ કેન્દ્રનાં પ્રતિનિધી પાર્થેશભાઈએ જણાવ્યું કે, આપણે ભલે આ કાર્ય માટે નોકરી કરતા હોઈએ કે ના કરતા

સો રાવ ફરીયાદ કરતા એક સ્મિત વધુ સારું.

હોય પણ એક ગામડાનાં વ્યક્તિ તરીકે ગામ માટે શું કરી શકે છે તેની વિસ્તાર પુર્વક માહિતી આપવામાં આવી.

૩. મારૂ સમાજમાં સ્થાન એટલે કે આપણે સમાજમાં કોઈપણ સ્થાન યા હોદ્દા ઉપર હોઈએ કે ના હોઈએ પણ ગામડા માટે આપણે ક્યું કામ કરી શકીએ કોઈપણ કામ પછી તે સૌથી મોટું હોય અથવા સૌથી નાનું હોય પરંતુ તે પણ ગામડાને આગળ લઈ જાય છે.

૪. પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય સમાજ વિશે તેજસભાઈએ સમજાવ્યું જેમાં ખાસ કરીને આજે મુખ્ય પ્રશ્ન જંગલ કપાતનો છે. યુવાનોને જંગલ કાપતા કેવી રીતે અટકાવી શકાય અને વનને લીધે જે આપણી સંસ્કૃતિ જળવાઈ રહેલી છે એમ જણાવ્યું ખાસ કરીને ધરમપુર, કપરાડા, વાંસદા જેવા ટ્રાઈબલ એરીયામાં યુવાનો વનને સાચવવાની કામગીરી શરૂ કરી દર વર્ષે ૨૦ થી ૩૦ વૃક્ષો રોપે અને તેનું જતન કરે જેથી પ્રકૃતિ પણ સચવાઈ રહે. તેમજ ગામડાઓમાં જે લોકનૃત્યો છે જે નાશ થતા રહ્યા છે તેને સાચવી રાખવામાં યુવાનો ભાગ ભજવે તેમજ પાણીનો ઉપયોગ સમજ પુર્વક કરે અને પ્રકૃતિની જાળવણી કરે તેવી સમજ આપવામાં આવી.

હરિરાજના કાર્યકર કીરણભાઈ ટંડેલએ સમજાવ્યું કે દર વર્ષે ઘણાં માણસો પોતાનો જન્મદિવસ ઉજવે છે અને ખર્ચ કરે છે તેનાં

બદલે દર જન્મ દિવસે વૃક્ષ વાવીએ અને હયાત વૃક્ષોનું જતન કરીએ.

૪. સામાજિક સમસ્યા અને તેનાં કારણો જેમાં બેરોજગારી, શિક્ષણનો અભાવ, અંધશ્રદ્ધા, બાળલગ્ન, કુટુંબ નિયોજનની વિગતે માહિતી આપવામાં આવી તેમાં યુવાનો સામેલ થઈ ગામડાનાં આ પ્રશ્નોને હલ કરે તેમ સમજાવવામાં આવ્યું.

૫. વ્યક્તિ ઘડતર અને સમાજ ઘડતર પર ગુજરાત વિદ્યાપીઠના પ્રીન્સીપાલશ્રીએ વ્યક્તિ ઘડતરની શરૂઆત કુટુંબથી જ થાય છે જેવો રંગ તેવો સંગ એ વાત પરથી સમજ આપી. બાળક જયારથી જન્મે છે ત્યારથી જ તેને સાડુ શિક્ષણ અને સંસ્કાર મળે તેમજ વ્યક્તિ પોતે સારા વિચાર કરી સારા કામ કરે જેથી ગામ અને સમાજનું ઘડતર સ્વસ્થ બને.

૬. અંતમાં હું શું કરી શકું ? આપણે જે કામ કરીએ છીએ તેમાં આગળ વધીને હું શું કરીશ એમ દરેક યુવાનોએ પોત પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગામનો યુવાન શું કરી શકે? તે માટે ગ્રામવિકાસને લગતી એક ફીલ્મ બતાવી.

છેલ્લે સંસ્થાના કાર્યાલયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નર્સરી, પ્લોટ, ખેતીમાં વપરાતા ઓજારોનો ઉપયોગ વિ. પ્રેક્ટીકલ કરીને સમજાવ્યું. બિયારણો વિશે માહિતી આપી તેમજ ડોક્યુમેન્ટ્રી ફીલ્મ બતાવી સમાપન કર્યું.

— રાકેશ પટેલ

કોઇ એ જીવનમા પડતી લાવવાનુ કાર્ય કરે છે.

દરિયાકાંઠાના ગામોનું સર્વેક્ષણ,

સૌરાષ્ટ્રનાં દરિયાકિનારા પર વસવાટ કરતા લોકોની મુશ્કેલીઓ પર સતત સરકારી તેમજ સ્વૈચ્છિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. સાગર ખેડુ જેવી ઘણી બધી યોજનાઓ પણ આ વિસ્તારનાં લોકો માટે અમલમાં છે પરંતુ પાયાના પ્રશ્નો હલ થવામાં હજુ લોકોને અસંતોષ જોવા મળે છે.



ખેતી આધારીત આજીવિકાની બાબતો પર શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રને ખાંભા તાલુકામાં ખેડુતો સાથે રહી કરેલી કામગીરીને ધ્યાનમાં લઈ સંસ્થાની ટીમ જાફરાબાદ તાલુકાનાં પાંચેક ગામોમાં જઈ ત્યાંની ખેતીની સરખામણી સંદર્ભે ગામ લોકો સાથે વાર્તાલાપ યોજયો હતો. જેમાં નાબાર્ડના વીલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાના કન્સેપ્ટને ધ્યાનમાં લઈ લોકો સાથે ચર્ચા કરી હતી. તેમજ સજજતાસંઘ – સીએસપીસી દ્વારા ચાલતા કામનાં સંદર્ભે પણ ત્રણેક ગામના રેન્ડમલી સીલેક્ટ કરેલા વ્યક્તિઓને મળી નિયત સર્વેક્ષણ કરવામાં આવ્યું.

લોકોની મુખ્ય સમસ્યા જમીનમાં વધતી ખારાશ છે. રેઢીયાળ પશુઓનો ત્રાસ તેમજ બિસ્માર રસ્તાઓને લઈને કામનાં સ્થળે પહોંચવામાં ખુબ મુશ્કેલીઓ જેવી બાબતો આ મુલાકાત દરમિયાન જાણવા મળી.

અત્યાચાર સહન કરનાર અત્યાચારી જેટલો જ ગુનેગાર છે.

આળસ એક સમસ્યા છે.

સાંભળીને થોડી નવાઈ લાગીને કે આળસને બિમારીમાં કેવી રીતે ખપાવી શકાય ?

પણ આળસ અને બિમારીને નજીકનો સંબંધ છે. વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે આળસ એક બિમારી છે. સામાન્ય રીતે આપણને કોઈ કામ ન કરવાની ઈચ્છા થાય છે ત્યારે તેને આપણે આળસ તરીકે ઓળખીએ છીએ. અથવા તો જ્યારે વધુ પડતું કાર્ય કરીએ અને પછી તે કરવામાંથી રૂચિ ઓછી થઈ જાય કે થાક લાગે તેને આળસ તરીકે ઓળખવામાં આવે છે. આમ એટલા માટે થાય છે, કારણકે આપણી શારીરિક સુસ્તી—સ્ફુર્તિ અને કાર્યપ્રણાલી કે ઉર્જાશક્તિ ક્ષીણ થાય છે. આમ બનવા પાછળ વિજ્ઞાનીઓ આરામદાયક ઉંઘ, અનિયમિત જીવનશૈલી અને શરીરને જરૂરી પોષણક્ષમ આહારના અભાવને જવાબદાર ઠેરવે છે. જો શરીરને જરૂરી પોષણમૂલ્યો મળી રહે તો કામ

કરવાનો ઉત્સાહ જાગે છે. અને કોઈ શારીરિક પરિશ્રમમાં થાક નથી લાગતો. એવું જ ઉંઘની બાબતમાં છે. જો પૂરતી ઉંઘ લેવામાં આવે તો પણ મન પ્રફુલ્લિત રહે છે, પ્રસન્નતા અનુભવે છે. અને કાર્ય કરવાનો ઉત્સાહ અને રૂચિ જળવાય રહે છે. અનિદ્રાને કારણે વ્યગ્રતા અનુભવાય છે, જેની સીધી કે આડકતરી અસર આપણા કામ અને શારીરિક તંદુરસ્તી પર પડે છે. આળસ ખંખેરવા માટે વિવિધ વિટામીન યુક્ત દવાઓ લેવામાં આવે છે, પરંતુ આળસ નામની બિમારી દૂર કરવા માટે પૂરતી ઉંઘ, નિયમિત જીવનશૈલી અને પોષણક્ષમ આહાર લેવાનું રાખીએ.

પ્રિય વાચક મિત્રો,

ટપક માટે આપ, સહયોગ રાશિ મોકલી શકો છો. ટપકને મોકલવામાં આવનાર આ રકમ ચેક અથવા ડ્રાફ્ટથી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનાં નામે મોકલવા વિનંતી છે.

આપની આસપાસ બનતા બનાવો કે જે બીજા લોકો માટે અનુકરણીય હોય તેની વિગતો ટપકને મોકલી શકો છો તેથી અન્ય લોકો તે વિશે માહિતગાર બનશે.

— ટપક ટીમ

Appreciate good job done.

Offer helping hand to colleague.

Let your work speak; do not praise your self.

Be compassionate, establish an office family.

Remain approachable, Listen to subordinate.

Be firm, not harsh.

Hurry delays, worry soils and anger spoils.

Agree / Apologies the mistakes & improvise.

Set goals, Monitor + Modify

Reach Before time, Finish Before time.

સમપર્ષ એ નમ્રતાનું જન્મ સ્થાન છે.

કન્વર્ઝન્સ કાર્યશાળા

પીવાનું પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રમાં કન્વર્ઝન્સ લાવી શકાય તથા પ્રદુષિત પાણીમાં સુધારો લાવવા માટે તા. ૨૪-૨૫ સપ્ટેમ્બર, ૧૦ ના રોજ ટાટમ ખાતે પ્રવાહ નેટવર્ક દ્વારા એક કાર્યશાળા યોજાઈ. જેમાં હેતલ વેકરીયા તથા ચંદ્રીકા મહિડાએ ભાગ લીધો હતો. કન્વર્ઝન્સના મુદ્દે કામ કરવા માટેનું ફ્રેમવર્ક તથા પ્રવાહ નેટવર્કની કામગીરીમાં કન્વર્ઝન્સની ઉપયોગિતા સમજી સંસ્થાકીય સ્તરે તથા રીઝીયન સ્તરે એક્શન પ્લાન બનાવવો તથા વીએપી અને વીડીપીના આયોજનમાં તેનો સમાવેશ કરવાની બાબતોને નેટવર્કના બધા સભ્યોએ સાથે મળીને આ કાર્યશાળામાં સમજ બનાવી.

માસ દરમિયાન થયેલ કામગીરી

૪,	રીવ્યુ પ્લાનીંગ સજ્જતાસંઘ અમદાવાદ
૧૧-૧૬,	દરિયાકાંઠાના ત્રણ ગામોનું સર્વેક્ષણ, જાફરાબાદ
૧૪-૧૫,	દબાણ જુથના સભ્યોની તાલીમ ડોળીયા
૧૪	એલઆઈસી એજન્ટની મીટીંગ ભાવનગર
૧૭	રીવ્યુ સેરીંગ મીટીંગ રાજકોટ
૨૧	કોરગૃપ મીટીંગ રાજકોટ
૨૪-૨૫	કન્વર્ઝન્સ તાલીમ ટાટમ
૨૪	પીઆઈએમસી મીટીંગ ખાંભા
૨૬	પેપરરીસાયકલ તાલીમ અમરેલી

માહિતી અધિકાર હેલ્પલાઈન : ૯૯૨૪૦૮૫૦૦૦

Printed, published and edited by Hardik Dhirajlal Vagadia on behalf of Educational & Social Welfare Centre, Published from Tapak Karyalay, 26-Omnagar-3, Hanumanpara Road, Amreli and printed at Geeta Graphics, F-1 Sahjanand market, Station road, Amreli.

Post Reg. No. L2/41/G-AMI-91/2008
Valid Upto 31/12/2011

RNI No. GUJGUJ/1999/01521
Date Of Issue 1st of month



Book -Post, Printed Matter

ટપક કાર્યાલય :

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર,
૨૬,ઓમનગર(૩), હનુમાનપરા રોડ,
ગોકુલ પાર્ક સામે, અમરેલી-૩૬૫ ૬૦૧.

Tel/Fax : 02792-223525

E-mail : tapak@sskkamreli.org website: www.sskkamreli.org

જરૂર કરતા વધારે દયાળુ હોય એ જીવનનો નવો નિયમ છે.